

## માહિતી પત્રિકા

### ગુજરાત ઠાકોર અને કોળી વિકસ નિગમ, ગાંધીનગર

(ગુજરાત સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળનું જાહેર સાહસ)

ભાઈઓ અને બહેનો/

- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગો પૈકી ઠાકોર અને કોળી જાતિઓના સર્વાંગી ઉત્કર્ષ માટે આ નિગમની રચના કરવામાં આવી છે.
- ભારત સરકારશ્રીના રાષ્ટ્રીય પછાતવર્ગ નાણાં અને વિકસ નિગમ, નવી દિલ્હીની ચેનલાઇઝીંગ એજન્સી તરીકે આ નિગમ કામ કરે છે. રાષ્ટ્રીય નિગમ તરફથી દર વર્ષે મંજૂર થયેલ લેનની રકમને ધ્યાનમાં લઈને સીધા ધિરાણની વિવિધ યોજનાઓનો અમલ કરવામાં આવે છે.
- ઠાકોર અને કોળી સમાજના નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા જરૂરિયાતમંદ લોકો સ્વમાનભેર સ્વરોજગારી મેળવી આત્મનિર્ભર બની જીવનમાં ઉન્નતિ કરી શકે તે ઉદ્દેશથી આ નિગમ દ્વારા વિવિધ યોજનાઓ જેવી કે કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ, લઘુ ઉદ્યોગો, કારીગરી અને પરંપરાગત ધંધા-વ્યવસાય, સેવાકીય ધંધા અને પરિવહન સેક્ટર હેઠળ લોન આપવામાં આવે છે. જે સંદર્ભમાં અરજી પત્રક ભરતાં પહેલાં આ માહિતી પત્રિકાનો અભ્યાસ કરવા વિનંતી છે.

જશવંત ગાંધી  
મેનેજીંગ ડીરેક્ટરશ્રી

પુંજાજી ઠાકોર  
અધ્યક્ષશ્રી

સૌનો સાથ સૌનો વિકસ

### લોન મેળવવાની પાત્રતાના મુખ્ય ધોરણો :-

- (૧) અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો પૈકી ઠાકોર અથવા કોળી જાતિના હોવા જોઈએ.
- (૨) અરજદારના કુટુંબની વર્ષ- ૨૦૧૩-૧૪ની કુલ વાર્ષિક આવક-  
ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૮૧,૦૦૦/- અને  
શહેરી વિસ્તાર માટે રૂ.૧,૦૩,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.
- (૩) અરજદારની ઉંમર અરજીની તારીખે ૨૧ થી ૪૫ વર્ષ સુધી હોવી જોઈએ.

આ માહિતી પત્રિકા અરજદારની જાણકારી અને ઉપયોગ માટે છે.

## મહત્વની બાબતો

- લોનની જરૂરિયાત હોય, તો જ ફોર્મ ભરવું. પોતાના નામે અન્ય કોઈ લોનનો ઉપયોગ કરવાના હોય તો લોન ન લેવી.
  - લોન જે ધંધા/વ્યવસાય માટે લીધી હોય તેના માટે જ ઉપયોગ કરવાનો રહેશે. અન્ય કોઈ હેતુ માટે આ રકમ વાપરી શકાશે નહિ.
  - મહિલાઓ, વિધવા અને વિકલાંગ વ્યક્તિઓ, સરકારી તાલીમ સંસ્થા / કે સરકાર માન્ય સંસ્થામાંથી મેળવેલ તાંત્રિક તાલીમવાળા બેરોજગાર વ્યક્તિઓને લોન મંજૂર કરવામાં અગ્રતા આપવામાં આવશે.
  - નિગમમાંથી અગાઉ લોન લેનાર અને બાકીદાર/ ડીફોલ્ટર થયેલ લાભાર્થીને કે તેના પતિ/પત્ની/પુત્રને લોન મંજૂર કરવામાં આવશે નહીં.
  - નિગમમાંથી લીધેલ લોનના હપ્તા ચાલુ હોય તેવા લાભાર્થીના કુટુંબના અન્ય સભ્યને લોન મંજૂરીમાં અગ્રતા આપવામાં આવશે નહીં.
  - મંજૂર કરવામાં આવનારી રકમ લોન છે તેમા કોઈ પણ પ્રકારની સબસીડીનો સમાવેશ થતો નથી. તેમજ ભવિષ્યમાં લોન માંડવાળ કરવામાં આવશે નહિ. લોનની પુરેપૂરી રકમ નિયત માસિક હપ્તામાં ભરવાની રહે છે. તે સમજીને/ ધ્યાનમાં રાખીને જ અરજી કરવી.
  - લોન નિયત માસિક ૬૦/૪૮ હપ્તામાં દેના બેન્કમાં અથવા નિગમના નામના ડ્રફ્ટ દ્વારા ભરવાની રહેશે.
  - અત્રે એ ઉલ્લેખનીય છે કે આ નિગમમાંથી અગાઉ લોન લેનાર ૧૫૦૦ જેટલા લાભાર્થીઓ સામે નિયમિત હપ્તા નહીં ભરવાના કારણે નામદાર ગાંધીનગર ડીસ્ટ્રીક કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ છે. અને લાભાર્થીઓએ ગાંધીનગર કોર્ટમાં સમન્સ મળતાં મુદતે હજાર રહેવું પડે છે.
  - નિગમમાં લોન અરજીની કાર્યવાહી માટે તેમજ લોનની મંજૂરી માટે કોઈ એજન્ટ /વ્યક્તિ / કર્મચારીને નાણાં આપવા નહીં. આ પ્રકારની કોઈ માંગણી કરે તો તે બાબત નિગમના અધ્યક્ષશ્રી /મેનેજીંગ ડીરેક્ટરશ્રીના ધ્યાને લાવવી.
- ❖ જાતિ અને આવકના પ્રમાણપત્રો નીચે દર્શાવેલ સક્ષમ અધિકારીઓ પાસેથી મેળવી રજૂ કરવાનાં રહેશે
- (૧) કલેક્ટર (૨) જીલ્લા વિકાસ અધિકારી (૩) મદદનીશ કલેક્ટર, નાયબ કલેક્ટર (૪) નાયબ જીલ્લા વિકાસ અધિકારી (૫) મામલતદાર (૬) તાલુકા વિકાસ અધિકારી (૭) જીલ્લા નાયબ નિયામક (વિજા) (૮) જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી(વિજા)
- (બ) ઉપર દર્શાવેલ અધિકારીઓ ઉપરાંત નીચેના અધિકારીઓ ફક્ત આવકને દાખલો આપી શકશે.
- (૧) નગરપાલિકા ચીફ ઓફિસર (૨) સર્વ રાજ્યપત્રિત અધિકારી (૩) નાયબ તાલુકા વિકાસ અધિકારી (૪) વિસ્તરણ અધિકારી (પંચાયત) (૫) નાયબ મામલતદાર

(ક) જ્યાં જાતિ અને આવકનું પ્રમાણપત્ર આપનાર સક્ષમ અધિકારી અલગ અલગ હોય ત્યાં આવક પ્રમાણપત્રો અલગ અલગ મેળવીને સ્જ કરવાના રહેશે.

લોન મંજૂર થાય તે પહેલાં નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જેથી જરૂરી દસ્તાવેજો પુરા કરી

શક્ય :-

- (૧) અરજદરે પોતાનું ખાતું રાષ્ટ્રીયકૃત બેન્કમાં ખોલાવવું સી.ટી.એસ. કોડવાળી માઇકર ચેકબુક મેળવવી.
- (૨) અરજદરે સ્થાવર મિલકત ઉપર બોજો કરાવવાનો રહેશે. એક જામીનદાર નક્કી કરવા તેમજ જામીનદારનું આધાર કાર્ડ /બારકોડેડ રેશન કાર્ડ /ચૂંટણી કાર્ડ અને તેમની સ્થાવર મિલકતના પુરાવા તૈયાર રાખવાં.

લોન માટે પાત્ર ધંધા /વ્યવસાય / યોજનાનું નામ		
દુધાળાઢોર / પશુપાલન)	કોમ્પ્યુટર જોબવર્ક	ઇલેક્ટ્રોનિક્સ આઇટમેનું રીપેરીંગ
કરીયાણાની દુકાન/ પ્રોવિઝન સ્ટોર્સ	પશુ આહારનું વેચાણ	ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી
રેડીમેડ કપડા/ ગારમેન્ટ સ્ટોર્સ	કોસ્મેટીકસની દુકાન	મીઠાઇ ફરસાણની દુકાન
મંડપ ડેકોરેશન	દસ્જી કામ	બ્યુટી પાર્લર
ઓટો રીપેરીંગ	ફોટો ફેમ અને પ્લાસ્ટીક લેમીનેશન	ફળ-ફળાટી અને શાકભાજીની દુકાન
સેન્ટીંગ કામ	આઇસ્ક્રીમ પાર્લર અને ઠંડપીણ	અન્ય નાના ગૃહઉદ્યોગ
વહલ્સ પોલીસીંગ	કઠ્ઠરી સ્ટોર્સ	
હીરા ઉદ્યોગ (સચમંડ કર્તીંગ એન્ડ પોલીસીંગ)	મોબાઇલ રીપેરીંગ	

## ધિરાણની મુખ્ય યોજનાઓની ટૂંકી માહિતી

### (૧) મુદતી લોન(ટર્મ લોન)

- (૧) લોનની મંજૂર કરવાપાત્ર મહત્તમ મર્યાદા રૂ. ૭૫ હજાર સુધી. (૨) વાર્ષિક વ્યાજદર ૬% વાર્ષિક.  
 (૩) લોનની રકમમાં ૮૫% રાષ્ટ્રીય નિગમ, ૧૦% રાજ્ય સરકારનો ફાળો અને ૫% લાભાર્થીફાળો.

### (૨) લઘુ ધિરાણ યોજના (માઇક્રો ફાઇનાન્સ )

- (૧) લોનની મંજૂર કરવાપાત્ર મહત્તમ મર્યાદા રૂ.૩૦ હજાર (૨) વ્યાજનો વાર્ષિક દર ૫%  
 (૩) લોનની રકમમાં ૮૦% રાષ્ટ્રીય નિગમ, ૫% રાજ્ય સરકારનો ફાળો અને ૫% લાભાર્થીફાળો

### (૩) મહિલા સમૃદ્ધિ યોજના (લઘુ ધિરાણ યોજના)

- (૧) લોનની મંજૂર કરવાપાત્ર મહત્તમ મર્યાદા રૂ.૩૦ હજાર (૨) વ્યાજનો વાર્ષિક દર ૪%  
 (૩) લોનની રકમમાં ૮૫% રાષ્ટ્રીય નિગમ, ૫% રાજ્ય સરકારનો ફાળો અને લાભાર્થીફાળો શૂન્ય.

### (૪) નવી સ્વર્ણિમ યોજના (ફક્ત મહિલાઓ માટે):-

- (૧) લોનની મંજૂર કરવાપાત્ર મહત્તમ મર્યાદા રૂ.૫૦ હજાર (૨) વ્યાજનો વાર્ષિક દર ૫%  
 (૩) લોનની રકમમાં ૮૫% રાષ્ટ્રીય નિગમ, ૫% રાજ્ય સરકારનો ફાળો અને લાભાર્થીફાળો શૂન્ય

### (૫) સ્વયંમ સક્ષમ યોજના:-

ઉચ્ચ વ્યવસાયિક શિક્ષણ પ્રાપ્ત કરેલ હોય અને તેમને પોતાની પ્રેક્ટીસ શરૂ કરવા માંગતા હોય તેઓને લોન ધિરાણ.

- (૧) લોનની મંજૂર કરવાપાત્ર મહત્તમ મર્યાદા રૂ.૧ લાખ (૨) વ્યાજનો વાર્ષિક દર ૫%  
 (૩) લોનની રકમમાં ૮૫% રાષ્ટ્રીય નિગમ, ૧૦% રાજ્ય સરકારનો ફાળો અને ૫% લાભાર્થીફાળો

### (૬) મુદતી ટર્મ લોન (પરિવહન માટે)

- (૧) લોનની મંજૂર કરવાપાત્ર મહત્તમ મર્યાદા રૂ.૨ લાખ સુધી (૨) વ્યાજનો વાર્ષિક દર ૬%  
 (૩) લોનની રકમમાં ૮૫% રાષ્ટ્રીય નિગમ, ૧૦% રાજ્ય સરકારનો ફાળો અને ૫% લાભાર્થીફાળો.  
 (૪) ડ્રાઇવીંગ લાયસન્સ અને ડ્રાઇવીંગનો અનુભવ જરૂરી.  
 (૫) વાહનની ઉપયોગીતા અને જરૂરિયાતનાં કારણોબી વિગતો.

૬૪૪૯ લાભાર્થીઓને રૂ.  
૨૮.૩૨ કરોડની લોન

ઉચ્ચ શિક્ષણ માટે રૂ.૧૦.લાખ સુધીની લોન

ન્યુ આક્રંક્ષા યોજના

નોલાભ લેવા સંપર્ક કરવો

૨૬૫ વિદ્યાર્થીઓને  
રૂ. ૪ કરોડની લોન

## ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ

બ્લોક નં.૧૬,ભોયતળિયે,ડૉ.જીવરાજ મહેતા ભવન,સેક્ટર-૧૦,ગાંધીનગર-૩૮૨૦૧૦

ફોન નં.(૦૭૯) ૨૩૨ ૫૬૪૮૬/ ૨૩૨ ૫૬૪૮૮ ફેક્સ નં.(૦૭૯) ૨૩૨ ૫૬૪૮૬

CIN : U 91990 GJ 2003 NPL 42945

વેબ સાઇટ:- [www.sje.gujarat.gov.in/gtkvn](http://www.sje.gujarat.gov.in/gtkvn)

ઈ-મેઇલ:- [md-gtkvn@gujarat.gov.in](mailto:md-gtkvn@gujarat.gov.in)

ગુટખા તથા તમાકુવાળા પાન મસાલા બંધ કરો.